

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

Happy Holi & Happy Dhuleti To All

તા.૨૪/૦૩/૨૦૧૬ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૪૩/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૬ કેસ કરી ૩૫ વ્યક્તિઓને ઝડપી ૩૮૫ લીટર દેશી દારૂ, ૩૨૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૮૮ બિયરટીન, ૦૧ મોટર સાયકલ, ૦૧ રીક્ષા અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી, ૦૧ વ્યક્તિને ઝડપી રોકડ રૂપિયા ૯૧૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૪૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૧૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં.૫૪૫/૧૬

સોલા હાઇકોર્ટ : અલ્પિતાબહેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.૧૭) (રહે.ગાયત્રીપાર્ક ભવનાથ સોસાયટી, ચાંદલોડીયા) ને તા.૨૧/૩/૧૬ નાં કલાક ૧૨/૧૫ વાગ્યાના સુમારે ઘર નજીક રહેતો આરોપી કિરણ વાસુભાઈ પટેલ શાયોના સ્કુલ નજીકથી લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ અલ્પિતાબહેનનાં પિતા મુકેશભાઈ પટેલે તા.૨૩/૩/૧૬ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.કે.શ્રીમાળી ચલાવે છે.

વેજલપુર : દિવ્યાંશીબહેન ગોપાલદાસ વૈષ્ણવ (ઉ.વ.૨૬) (રહે.શક્તીનગર સોસાયટી, સીમલા હોટલની પાછળ, ગુપ્તાનગર, વાસણા) ને તા.૧૩/૩/૧૬ નાં કલાક ૩/૩૦ થી ૪/૧૫ વાગ્યા દરમિયાન ઘર નજીક રહેતો આરોપી લલ્લો ઉર્ફે લવ બાલમુકુંદ ગોસ્વામી વાસણા ગુપ્તાનગર શાંતાબાગ રોડ, રિવર સાઇટ પાર્કથી, લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ દિવ્યાંશીબહેનનાં ભાઈ નરેશભાઈ વૈષ્ણવે તા.૨૩/૩/૧૬ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.કે.ઝાલા ચલાવે છે.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૫૪૬/૧૬

વટવા : સુરેન્દ્રભાઈ સુરજભાન અગ્રવાલ (રહે.સનરાઈઝ પાર્ક, હિમાલયા મોલની સામેની ગલીમાં) એ તા.૨૩/૩/૧૬ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે દોઢ વર્ષ પહેલાથી આજદિન સુધીનાં સમયગાળા દરમ્યાન આરોપી દિપક અગ્રવાલ (રહે.વી.આર.પોલીકેબ પ્રા.લી.કંપની પીપળજ રોડ, વટવા) નાએ સુરેન્દ્રભાઈનો કાપડનો માલ કુલ ૫૦,૦૦૦ મીટર કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦/- નો પ્રોસેસ માટે લઈ જઈ, પ્રોસેસ દરમ્યાન બગાડી નાંખી, અગાઉ દોઢ લાખ રૂપિયા મેળવી લીધા બાદ, સુરેન્દ્રભાઈનો ૧૫,૦૦૦ મીટર માલ પોતાની પાસે રોકી રાખી, બીજા એક લાખ રૂપિયાની માંગણી કરી, ધાક-ધમકી આપી સુરેન્દ્રભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ. કે.એસ.પટેલ ચલાવે છે.

રોકડ મુકેલ થેલી ખેંચી ઝુંટવી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૫૪૭/૧૬

કાલુપુર : મીઠાલાલ નેમીચંદ બોહરા (રહે,રૂષીકા એપાર્ટમેન્ટ, સુજાતા ફ્લેટની બાજુમાં, શાહીબાગ) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૩/૧૬ સવારના ૧૧/૩૦ વાગ્યાના સુમારે બી.બી.સી.માર્કેટ, બેંક ઓફ બરોડાનાં ગેટ નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક અજાણ્યો પુરૂષ મીઠાલાલે બગલમાં દબાવેલ થેલી, જેમાં રોકડ રૂપિયા ૫૩,૦૦૦/- હતા, જે રોકડ મુકેલ થેલી ખેંચી ઝુંટવી નાસી ગયો છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એમ.ડી.ઉપાધ્યાય ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૫૪૮/૧૬

ઘાટલોડીયા : કૃણાલ કિશોરભાઈ વછેટા (ઉ.વ. ૧૯) (રહે, ભાવિન સોસાયટી, કે.કે.નગર ચારરસ્તા પાસે, જ્યુપીટર સોસાયટી સામે, ઘાટલોડીયા) એ કોઈ અગમ્ય કારણસર તા.૨૩/૩/૧૬ સવારના ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના મકાનની ઉપરના માળની ઓરડીમાં, લાકડાની વળી સાથે દુપટ્ટો બાંધી, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી કમલેશભાઈ કાળાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.